

Zandu Foundation for Health Care (ZFHC)

કૌચા (*Mucuna pruriens*)

લોકલ નામ : કૌચા (કુવેચ)

વैજ્ઞાનિક નામ : *Mucuna pruriens*

ફેમીલી : ફેઝેસી

શાસ્ત્રીય નામ : આત્મ ગુપ્ત - કૌચા

ઉપયોગ ભાગ : બીજ

મુખ્ય રાસાયણિક તત્ત્વ : એલ - ડોપા

છોડનો પ્રકાર : વેલા

છોડની ઊંચાઈ : ૮ થી ૧૦ મીટર

છોડનું ચક્ક : જુન થી જાન્યુઆરી (૮ મહિના)



ભારતના કુદરતી રીતે જંગલોમાં

ચોમાસામાં જોવામાં આવતો વેલાવાળો છોડ જાડ તેમજ વાડ પર ચઢી જાય છે. કૌચાને સ્થાનિક ભાષામાં કુવેચ કહે છે. વાલના પાનની જેમ તેના ત્રણ પાન થાય છે. વેલા પર ભુરા રંગના ફુલ બેસે છે પછી તેમાંથી વાલોડ પાપડીની જેમ ગુચ્છેદારમાં પથી ૧૫ સીંગો એક જુમખામાં આવે છે. દેશી જાતની સિંગો પર નાની રૂવાટી હોય છે. કૌચાના બીજમાં ઔષધ તત્ત્વ તરીકે આલ્કેલોઇડ મ્યુકેન અને ભ્યુનાડીન હોય છે. તેમા ઘરું તેલ, ટેનિન અને ડાઈ-હાઈડ્રોક્સી ફીનાઈલ એલીનીન (એલ-ડોપા) રહેલા હોય છે. એલ-ડોપા કંપાવાત અને ચેતાતંત્રને લગતા રોગો ઉપર કામ આવે છે.

જમીન અને આબોહવા : મોટા ભાગની બધા જ પ્રકારની સારા નિતાર ધરાવતી જમીન અનુકૂળ છે. ગોરાડુ તથા મધ્યમ કાળી જમીનમાં તેનો વિકાસ સારો થાય છે. આ પાક માટે ગરમ અને ભેજવાળું પાકવાના સમયે સુકુ ઠંડુ વાતાવરણ માફક આવે છે.

જમીનની તૈયારી : ઉનાળામાં એક-બે વખત ખેડ કરી જમીન તૈયાર કરવી. જમીનની ફળદુપતા જળવાઈ રહેતે માટે એકટર દીઠ ૧૦ ટન છાણીયું ખાતર ભેળવવું.

વાવણીનો સમય : જુનમાં સારો વરસાદ થયા પછી તેના બીજની વાવણી કરવી. બીજને રોપતા પહેલા અને રાત્રે પાણીમાં પલાળી રાખી વાવવા. ૧.૫ મીટરના અંતરે વાવણી કરવાથી પીયત માટે નીકો અને વેલાની વૃદ્ધિ માટે ઊંચી જગ્યા મળે છે.

વાવણીનું અંતર : આ બીજને ૧x૧ મીટર અંતરે વાવણી કરવી.

બીજનો દર : એક હેક્ટરની વાવણી કરવા માટે ૮ થી ૧૫ કિ.ગ્રા. બિયારણની જરૂર પડે છે. બીજ દેખાવમાં વાલ જેવા હોય છે. ૧ કિ.ગ્રા. માં ૬૦૦ થી ૭૫૦ બીજ આવે છે.

સપોર્ટ : વેલાને ચડાવવા માટે મંડપ કરી શકાય તો ખુબ જ સારુ જેથી ઉત્પાદન વધુ મળી શકે છે. ઝાડ પર તો ૧૫ થી ૨૦ ફૂટ લાંબા વેલા ચઢી જાય છે.

ખાતર : આમ તો કૌચાના પાકને ખાતર આપવું જરૂરી નથી છતા પણ છોડનો વિકાસ ન થયો હોય તો વાવણી પછી ત૦ થી ૪૦ દિવસમાં ૬૦ કિ.ગ્રા. નાઈટ્રોજન પ્રતિ હેક્ટર આપવું.

પીયત : સામાન્ય રીતે સારો વરસાદ હોય તો પીયતની જરૂર પડતી નથી પરંતુ વરસાદ ખેચાય તથા જરૂર જણાય તો સપેભર ઓક્ટોબર માસ સુધી પીયત આપવું જરૂરી છે.

પાકસંરક્ષણ :

જીવાત :

મોલો : આ પાકમાં કુમળી હુંખો ઉપર ઓક્ટોબર - નવેમ્બર માસ પછીથી મોલોનો ઉપદ્રવ જણાય છે. તેના નિયંત્રણ માટે ડાય મિથોએટ ૦.૩ % પ્રમાણે છંટકાવ કરવો.

રોગ : આ રોગની શરૂઆતમાં રોગ વાળા છોડને દુર કરી તેનો નાશ કરવો.

કાંપણી : ઇસેમ્બર જાન્યુઆરી માસમાં સીંગો પાકી થઈ જાય છે. સીંગો લીલા કલરમાંથી કાળા રંગની થઈ જાય એટલે પાકી થઈ ગયેલી સમજવી. સીંગો તોડવામાં થોડું મોદુ થઈ જાય તો ફાટી જાય છે. બધી સીંગો ઊતારી લઈ બીજ કાઢવું ખુબ જ સહેલું છે.

ઉત્પાદન : સામાન્ય રીતે કૌચાના બીજનું ઉત્પાદન હેક્ટર દીઠ ૭૦૦ થી ૮૦૦ કિ.ગ્રા. પ્રતી હેક્ટર બીજનું ઉત્પાદનમળે છે. ઉપરાંત શક્ય હોય તો ખેતરની વાડે પણ વ્યવસ્થિત વાવેતર કરી સારુ ઉત્પાદન મેળવી શકાય છે.



Quality parameters as per API

Parameters	API standards*
Foreign matter	Not more than 1%
Total ash	Not more than 5 %
Acid-insoluble ash	Not more than 1 %
Alcohol-soluble extractive	Not less than 3 %
Water-soluble extractive	Not less than 3 %
Fixed oil	Not less than 3 %

*API-Ayurvedic Pharmacopoeia of India.



વધુ માહિતી માટે સંપર્ક:

સાઈન્ટીસ ઈચ્છાજી,
અંગુ ફાઉન્ડેશન ફોર હેલ્પ કેર

ગામ : અંબાચ, તાઃ પારડી, જી. વલસાડ - ૩૮૬ ૧૪૫

E-mail : zfhc.farm@gmail.com,
info@zandufoundation.com

website : www.zandufoundation.com

ફોન નંબર : ૦૨૬૦૨૩૧૮૨૧૭/૧૮